

I.C.E

લીડ્સ જનરેશન માર્ગદર્શિકા

સંભવિત લીડ કેવી રીતે ઓળખશો?



ઈચ્છુક ગ્રાહક

વિશિષ્ટ લોન
જોઈએ છે



સંપર્કક્ષમતા

ગ્રાહકનો સંપર્ક કરવો
શક્ય હોવું જોઈએ



પાત્રતા

ગ્રાહક પાત્રતા માપદંડોનું
પાલન કરતા હોવા જોઈએ



AXIS BANK



બી2સી - કેસીસી / ઓડીકોન - કિસાન સમર્થ



લક્ષિત ગ્રાહકો

વ્યક્તિગત અને પ્રગતિશીલ ખેડૂતો




ઉપલબ્ધ સુવિધાઓ

કેશ કેડિટ 5 વર્ષ સુધી,
ટર્મ લોન 7 વર્ષ સુધી



ઉંમર

18 વર્ષ - 75 વર્ષ
જો 60 વર્ષથી વધુની
ઉંમર હોય તો કૌ-બોરોઅર
આવશ્યક રહેશે



ખેતીની ઓછામાં ઓછી જમીન માલિકી

કેસીસી-1 એકર - સંયુક્ત માલિકી -
5 જેટલાં સંયુક્ત માલિકો
ઓડીકોન - 0.5 એકર
કિસાન સમર્થ - 5 એકર
3 થી 5 એકર જમીન (મંજૂરી પર આધારિત)



લોનની રકમ

કેસીસી - રૂ.25,000 થી રૂ.2.5 કરોડ
ઓડીકોન - રૂ.1 લાખ થી રૂ.5 કરોડ
કિસાન સમર્થ - રૂ.1 લાખ થી રૂ.5 કરોડ

બી2બી રિટેલ અને એમ.એસ.એમ.ઈ.

એજીપ્રો પાવર



લક્ષિત ગ્રાહકો

ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ
એકમો માટે.



બંધારણ

વ્યક્તિગત (માન્ય લાઈસન્સને આધીન) / પ્રોપરાઈટરશિપ /
પાર્ટનરશિપ / પ્રા. લિ. કંપની / લિમિટેડ કંપની / એલએલપી



ઉંમર માપદંડ

21 વર્ષ - 65 વર્ષ



વિન્ટેજ

ઓછામાં ઓછી 3 વર્ષ જુની અને એકમનું ITR છેલ્લા
2 વર્ષથી પ્રોફિટમાં જોઈએ
એજીપ્રો લાઈટ માટે: 1 વર્ષ



લોનની રકમ

એજીપ્રો પાવર: ઓછામાં ઓછી
₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 10 કરોડ
એજીપ્રો લાઈટ: ઓછામાં ઓછી
₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 1 કરોડ



સ્વીકાર્ય કોલેટરલ્સ

રહેણાંક, વ્યાપારિક, ઔદ્યોગિક મિલકત,
ફેક્ટરી, ગોડાઉન, એનએ ઓપન પ્લોટ,
ગ્રામ પંચાયત મિલકત

કિસાન મિત્ર (કેએમ)



લક્ષિત ગ્રાહકો

કૃષિ સેવા પૂરી પાડનારાઓ માટે
એગ્રિ વેલ્યુ ચેઈન પાર્ટનર્સ



બંધારણ

વ્યક્તિગત (માન્ય લાઈસન્સને આધીન) / પ્રોપરાઈટરશિપ /
પાર્ટનરશિપ / પ્રા. લિ. કંપની / લિમિટેડ કંપની / એલએલપી



ઉંમર માપદંડ

21 વર્ષ - 65 વર્ષ



વિન્ટેજ

ઓછામાં ઓછી 3 વર્ષ જુની અને એકમનું ITR છેલ્લા 2 વર્ષથી પ્રોફિટમાં જોઈએ
કિસાન મિત્ર લાઈટ માટે: 1 વર્ષ



લોનની રકમ

કિસાન મિત્ર: ઓછામાં ઓછી
₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 10 કરોડ
કિસાન મિત્ર લાઈટ: ઓછામાં ઓછી
₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 1 કરોડ



સ્વીકાર્ય કોલેટરલ્સ

રહેણાંક, વ્યાપારિક, ઔદ્યોગિક મિલકત,
ફેક્ટરી, ગોડાઉન, એનએ ઓપન પ્લોટ,
ગ્રામ પંચાયત મિલકત

એમ.એસ.એમ.ઈ. સમૃદ્ધિ

લક્ષિત ગ્રાહકો



સ્વ-રોજગાર ધરાવતા નોન-પ્રોફેશનલ્સ - ઉત્પાદકો, વેપારીઓ અને સેવા પ્રદાતાઓ એજીપ્રો પાવર અને કિસાન મિત્રમાં પહેલા જ આવરી લેવાયા છે તે ઉપરાંતના. સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો - ડોક્ટરો, આર્કિટેક્ટરો, સીએ વગેરે.

બંધારણ



વ્યક્તિગત (માન્ય લાઈસન્સને આધીન) / પ્રોપરાઈટરશિપ / પાર્ટનરશિપ / પ્રા. લિ. કંપની / લિમિટેડ કંપની / એલએલપી

વિન્ટેજ



ઓછામાં ઓછી 3 વર્ષ અને એકમનું ITR છેલ્લા 2 વર્ષથી પ્રોફિટમાં જોઈએ એમએસએમઈ લાઈટ માટે: 1 વર્ષ



લોનની રકમ

એમએસએમઈ: ઓછામાં ઓછી ₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 10 કરોડ.
એમએસએમઈ લાઈટ: ઓછામાં ઓછી ₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 1 કરોડ.

સ્વીકાર્ય કોલેટરલ્સ



રહેણાંક, વ્યાપારિક, ઔદ્યોગિક મિલકત, ફેક્ટરી, ગોડાઉન, એનએ ઓપન પ્લોટ, ગ્રામ પંચાયત મિલકત



ઉંમર માપદંડ

21 વર્ષ - 65 વર્ષ

કિવક જીએસટી મેકસ

લક્ષિત ગ્રાહકો



ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ એકમો, કૃષિ સેવા પ્રદાતાઓ, એગ્રિ વેલ્યૂ ચેઈન પાર્ટનર્સ, એમએસએમઈ નોન એગ્રિ ગ્રાહકો

બંધારણ



વ્યક્તિગત (માન્ય લાઈસન્સને આધીન) / પ્રોપરાઈટરશિપ / પાર્ટનરશિપ / પ્રા. લિ. કંપની / લિમિટેડ કંપની / એલએલપી

વિન્ટેજ



ઓછામાં ઓછી 3 વર્ષ અને એકમનું ITR છેલ્લા 2 વર્ષથી પ્રોફિટમાં જોઈએ



લોનની રકમ

ઓછામાં ઓછી ₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 2 કરોડ

સ્વીકાર્ય કોલેટરલ્સ



રહેણાંક, વ્યાપારિક, ઔદ્યોગિક મિલકત, ફેક્ટરી, ગોડાઉન, એનએ ઓપન પ્લોટ, ગ્રામ પંચાયત મિલકત



ઉંમર માપદંડ

21 વર્ષ - 65 વર્ષ

સીક્યોર્ડ ટર્મ લોન (એસટીએલ)



લક્ષિત ગ્રાહકો

ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ એકમો, કૃષિ સેવા પ્રદાતાઓ, એગ્રિ વેલ્યૂ ચેઇન પાર્ટનર્સ, એમએસએમઈ નોન એગ્રિ ગ્રાહકો



લોનનો હેતુ

ટર્મ લોન અને ડ્રોપલાઈન ઓવર ડ્રાફ્ટ જનરલ બિઝનેસ તેમ જ કમર્સિયલ પ્રોપર્ટી ખરીદવા માટે.



બંધારણ

વ્યક્તિગત (માન્ય લાઈસન્સને આધીન) / પ્રોપરાઈટરશિપ / પાર્ટનરશિપ / પ્રા. લિ. કંપની / લિમિટેડ કંપની / એલએલપી



વિન્ટેજ

ઓછામાં ઓછી 3 વર્ષ અને એકમનું ITR છેલ્લા 2 વર્ષથી પ્રોફિટમાં જોઈએ



લોનની રકમ

ઓછામાં ઓછી ₹ 10.01 લાખ થી વધુમાં વધુ ₹ 5 કરોડ



સ્વીકાર્ય કોલેટરલ્સ

રહેણાંક, વ્યાપારિક, ઔદ્યોગિક મિલકત, ફેક્ટરી, ગોડાઉન, એનએ ઓપન પ્લોટ, ગ્રામ પંચાયત મિલકત



ઉંમર માપદંડ

ઉંમર 21 વર્ષ - 65 વર્ષ
મુદત 15 વર્ષ સુધીની

ગોલ્ડ લોન માટેની પાત્રતા



લક્ષિત ગ્રાહકો

વ્યક્તિઓ
(માત્ર ભારતીય
નિવાસી)



ઉંમર

18 - 75
વર્ષ



ભૌગોલિક સીમા

રહેણાંક / શાખાથી
50 કિમી. ની
અંદર આવેલી ખેતીની
પ્રવૃત્તિઓની જગ્યા



સ્વીકાર્ય ગોલ્ડ કરેટ

18 કરેટ અને વધુ

ટ્રેક્ટર લોન માટેની પાત્રતા



લક્ષિત ગ્રાહકો

- સ્વયંને ખેતી માટે ઉપયોગ: વ્યક્તિઓ / પ્રોપરાઈટરશિપ ફર્મ્સ
- વ્યાપારિક ઉપયોગ: વ્યક્તિઓ / પ્રોપરાઈટરશિપ ફર્મ્સ, પાર્ટનરશિપ ફર્મ્સ, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ / પબ્લિક લિમિટેડ કંપનીઓ



ઉંમર

18 - 65 વર્ષ
(લોન બંધ
થવા સમયે)

ઑટો લોન માટેની પાત્રતા



લક્ષિત ગ્રાહકો

- પગારદાર અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા.
- સ્વ-રોજગાર ધરાવવા સાથે એ જ બિઝનેસમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા



ઉંમર

ઓછામાં ઓછી
21 થી 70 વર્ષ



જરૂરી ઓછામાં ઓછી આવક*

- પગારદાર માટે: ₹ 20,000 દર મહિને.
- સ્વ-રોજગાર માટે: દર વર્ષે ₹ 2 લાખ

ટુ વ્હીલર લોન માટેની પાત્રતા



લક્ષિત ગ્રાહકો

- પગારદાર અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા.
- સ્વ-રોજગાર ધરાવવા સાથે એ જ બિઝનેસમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા



ઉંમર

21 - 65 વર્ષ



જરૂરી ઓછામાં ઓછી આવક*

- પગારદાર ગ્રાહક: દર મહિને ₹ 14,000
- સ્વ-રોજગાર ગ્રાહકો: દર વર્ષે ₹ 2.5 લાખ

*માત્ર વેનિલા (આવકનો પુરાવો) સ્કીમ મારફત થયેલા કેસો માટે લાગુ.

કમર્સિયલ વેહિકલ અને કમર્સિયલ ઈક્વિપમેન્ટ લોન માટેની પાત્રતા




લક્ષિત ગ્રાહકો

ફ્રેઈટ ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, માર્કેટ લોડ ઓપરેટર્સ, માઈનિંગ ઓપરેટર્સ, બિલ્ડર્સ અને ડેવલપર્સ, સ્કૂલ્સ




ઝાણ લેનાર બંધારણ

વ્યક્તિગત પ્રોપરાઈટરો, પાર્ટનરશિપ પેઢીઓ અને એલએલપી, એચયુએફ, પબ્લિક અને પ્રાઈવેટ લિ. કંપની, ટ્રસ્ટ્સ અને સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એનપીઓ, એસોસિએશન ઓફ પર્સન્સ



વેહિકલ્સના પ્રકારો

ટ્રક્સ, બસ, ટ્રેલર, ટિપર્સ, એક્સકેવેટર્સ, ક્રેન્સ, બેકહો લોડર્સ



વ્યવસાયની સ્થિરતા

નવા વાહનો માટે ઓછામાં ઓછો 2 વર્ષનો બિઝનેસ અનુભવ અથવા ઓછામાં ઓછી 2 એકર ખેતીની જમીન



અપાત્રતા

પગારદાર કર્મચારીઓ, બિન નિવાસી ભારતીયો, નોંધણી ન થયેલ પેઢીઓ અને ટ્રસ્ટો

હોમ લોન માટેની પાત્રતા



લક્ષિત ગ્રાહકો:

ભારતના નિવાસી:

પગારદાર

- સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો
- સ્વ-રોજગાર ધરાવતા બિન-વ્યાવસાયિકો



બિન-નિવાસી ભારતીય

પગારદાર અને સ્વ-રોજગાર બંને



ઉંમર

ઓછામાં ઓછી: 21 વર્ષ

વધુમાં વધુ: 65 વર્ષ અથવા નિવૃત્તિની ઉંમર, જે પણ વહેલું હોય તે (લોન પરિપક્વતા સમયે)



ઓછામાં ઓછી જરૂરી આવક

પગારદાર ગ્રાહક: ₹ 15,000 દર મહિને

સ્વ-રોજગાર ગ્રાહક: ₹ 1.8 લાખ દર વર્ષે



લોનની રકમ

લોનની ઓછામાં ઓછી રકમ: ₹ 3 લાખ

લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની પાત્રતા



લક્ષિત ગ્રાહક

કોઈપણ ગ્રાહક જે પગાર અથવા બિઝનેસની આવક ધરાવતા હોય અને મિલકતના માલિક હોય અથવા વ્યાપારિક મિલકત ખરીદવા ઈચ્છતા હોય અથવા વ્યક્તિગત કે બિઝનેસમાં ઉપયોગ માટે નાણાંની જરૂર ધરાવતા હોય.



ઉંમર

21 - 65 વર્ષ (લોન બંધ થવા સમયે)



લોનની રકમ- એલએપી ઓછામાં ઓછી ₹ 5 લાખ

નોન એમએસએમઈ માટે અને ₹ 10 લાખ

એમએસએમઈ માટે.

મહત્તમ ₹ 10 કરોડ આવક, એલઆરડી માટે અને ₹ 8

કરોડ બેન્કિંગ માટે તથા ₹ 5 કરોડ અન્ય સરોગેટ્સ માટે



ઓછામાં ઓછી જરૂરી આવક

• પગારદાર ગ્રાહક: ₹ 10,000 દર મહિને

• સ્વ-રોજગાર ગ્રાહક: ₹ 1.8 લાખ દર વર્ષે

આશા હોમ લોન

લક્ષિત ગ્રાહક



કોઈપણ ગ્રાહક કે જે પગાર અથવા બિઝનેસની આવક ધરાવતા હોય અને રહેણાંક મિલકત / જમીનનો પ્લોટ ખરીદવા અને તેના પર ઘર બાંધવા / માલિકીની જમીનના પ્લોટ પર ઘર બાંધવા ઈચ્છતા હોય / બેલેન્સ ટ્રાન્સફર માટે.

ઉંમર



21 - 65 વર્ષ
(લોન બંધ થવા સમયે)

જરૂરી આવક



પગારદાર: ₹ 8,000 દર મહિને
(રોકડો પગાર સ્વીકાર્ય)
એસઈપી અને એસઈએનપી: ₹ 1.2 લાખ વાર્ષિક



લોનની રકમ- લોનની ઓછામાં ઓછી રકમ: ₹ 1 લાખ | લોનની વધુમાં વધુ રકમ: ₹ 50 લાખ
(લોનની મહત્તમ રકમ ₹ 1 કરોડ છે આશા પ્રીમિયમ લોન્સ માટે)

આશા લોન અગેન્સ્ટ પ્રોપર્ટી

લક્ષિત ગ્રાહકો



આશા એલએપી એક માર્ફકો-લેપ છે જે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેંટ માટે છે. કોઈપણ ગ્રાહક જે બેન્ક સેલેરી/કેશ સેલેરી અથવા બિઝનેસ આવક ધરાવે છે અને મિલકતના માલિક છે અથવા કમર્સિયલ પ્રોપર્ટી ખરીદવા યાદે છે કે પછી પર્સનલ અથવા બિઝનેસના ઉપયોગ માટે ફંડ્સની જરૂર ધરાવે છે.

ઉંમર



21-65 વર્ષ
(લોન બંધ થવા સમયે)

આવશ્યક આવક



પગારદાર: ₹ 10,000 દર મહિને
(કેશ સેલેરી સ્વીકાર્ય)
એસઈપી અને એસઈએનપી: ₹ 1.2 લાખ વાર્ષિક



લોનની રકમ

લોનની ઓછામાં ઓછી રકમ: ₹ 10 લાખ કમ્બાઈન્ડ એક્સપોઝર લોનની મહત્તમ રકમ ₹ 100 લાખ છે.

એસબીબી - કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ પાત્રતા

ઉંમર



21 - 70 વર્ષ



ટર્નઓવર

₹ 30 લાખ થી
₹ 30 કરોડ



બિઝનેસનો ઓછામાં
ઓછો અનુભવ
3 વર્ષ



જરૂરી ઓછામાં ઓછી આવક

બિન વ્યક્તિગત માટે: પોઝિટિવ ચોખ્ખો નફો અને ₹ 3 લાખનો રોકડો નફો.
સોલ પ્રોપરાઈટરશિપ / વ્યક્તિગત - છેલ્લા 2 વર્ષ માટે ₹ 2.5 લાખની ITR ઈન્કમ.

એસબીબી - સીક્યોર્ડ ટર્મ લોન માટેની પાત્રતા



ઉંમર
21 - 70 વર્ષ



ટર્નઓવર
₹ 30 લાખ થી
₹ 30 કરોડ



બિઝનેસની વિન્ટેજ
ઓછામાં ઓછો 3 વર્ષ



જરૂરી ઓછામાં ઓછી આવક

વ્યક્તિઓ માટે- આઈટીઆર ઈન્કમ છેલ્લા વર્ષ માટે ₹ 300000 અને પાછલા વર્ષ માટે ₹ 250000. પ્રોપરાઈટરશિપ કન્સન્સ- છેલ્લા 2 વર્ષ માટે ₹ 250,000 ની આઈટીઆર ઈન્કમ પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, કંપનીની- પીએટી સકારાત્મક હોવો જોઈએ અને છેલ્લા 2 વર્ષમાં ટેક્સ ભર્યો હોવો જોઈએ. છેલ્લા 2 વર્ષ માટે ₹ 300,000 કેશ પ્રોફિટ



માલિકી
ઓફિસ / ઘર


એસબીબી - બિઝનેસ લોન



ઉંમર
21 - 65 વર્ષ (ડોક્ટરો માટે 24-65 વર્ષ)



ટર્નઓવર
₹ 30 લાખ થી ₹ 1 કરોડ



બિઝનેસની માલિકી
ઓછામાં ઓછા 3 વર્ષ (ડોક્ટર માટે 2 વર્ષ)



માલિકી
ઓફિસ / ઘર



ઓછામાં ઓછી આવક

બધાં જ પ્રોગ્રામ્સ હેઠળ ઓછામાં ઓછા ₹ 3 લાખ

અસ્વીકરણ:
ઈટીબી - એક્ઝિસ્ટિંગ ટુ બેન્ક
એનટીબી - ન્યૂ ટુ બેન્ક

પર્સનલ લોન માટેની પાત્રતા




લક્ષિત ગ્રાહકો
પગારદાર વ્યક્તિઓ



ઉંમર
21 - 60 વર્ષ
(લોન બંધ થવા સમયે)



કાર્ય અનુભવ
ઓછામાં ઓછા 12 મહિના



જરૂરી ઓછામાં ઓછી આવક*

- સીએસજી 35કે, નોન સીએસજી- 40કે • આવક ધોરણો (એનટીબી) -50કે • બ્યુરો સ્કોર -740
- કંપની કેટેગરી (સીએસજી)- એસસીએટીએ, સીએટીજીએ, સીએટીજીબી, પીઓએલ, ગવર્મેન્ટ, ડીઈએફ
- કંપની કેટેગરી (નોન સીએસજી અને એનટીબી) એસસીએટીએ, સીએટીજીએ, સીએટીજીબી, કેન્દ્ર સરકાર

*કૃપા કરી નોંધ લેશો:
સીએસજી - (કોર્પોરેટ સેલરી અકાઉન્ટ ધારકો) એક્સિસ અકાઉન્ટમાં ઓછામાં ઓછી 2 સેલરી જમા થયેલ.
ઈટીબી નોન-સીએસજી-સેવિંગ્સ અકાઉન્ટ ઓછામાં ઓછા 2 મહિનાના વિન્ટેજ સાથે.
ઈટીબી - એક્ઝિસ્ટિંગ ટુ બેન્ક
એનટીબી - ન્યૂ ટુ બેન્ક

એજ્યુકેશન લોન



લક્ષિત ગ્રાહકો

25 થી 35 વર્ષ વિદ્યાર્થીઓ માટે
50 થી 58 વર્ષ માતા-પિતા માટે



ગ્રાહક પ્રકાર

પગારદાર / સ્વ-રોજગાર



આવકના માપદંડ

બ્યુરો સ્કોર - પગારદાર(એસ) - 740 અને સેલ્ફ એમ્પ્લોઈડ (એસઈ) -740

આવકના ધોરણો- સીએસજી / એક્સિસ સેલેરી અકાઉન્ટ - (એસ) 40 હજાર દર મહિને અને (એસઈ) 4.8 લાખ

વાર્ષિક આઈટીઆર આવક ધોરણો (નોન સીએસજી) - (એસ) - 50 હજાર દર મહિને, (એસઈ) - 50 હજાર દર

મહિને એબીબી - (એસ) - 1.5 ગણાં, (એસઈ) - 1.5 ગણાં



ઉંમર

અરજીકર્તા: કોઈ ઉંમર પ્રતિબંધ નહીં

સહ-અરજીકર્તા: 60 સુધી મોરેટોરિયમ મુદત પૂરી થવા સમયે

આભાર